



ડો. એન. બી. ધોળકીયા

અધિક નિયામક (તબીબી સેવાઓ)

નં. "મા વાત્સલ્ય" યોજના/ નવી કેટેગરીની
માર્ગદર્શિકા બાબત/ ૨૦૧૭, બ.નં. ૪૭૬

કમિશ્નરશ્રી, આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી
શિક્ષણ (પ.ક.), ઓબ્લોક નં.૫, ડો.જીવરાજ મહેતા
ભવન, ગાંધીનગર.

તા-૧૯-૧૧-૨૦૧૭

વંચાણે લીધું: -

- (૧) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.૦૪/૧૦/૨૦૧૭ ના ઠરાવ ક્રમાંક:-એફપીડબલ્યુ
૧૦૨૦૧૭/૮૭૨/બ.૧ સચિવાલય, ગાંધીનગરના ઠરાવ અન્વયે.
- (૨) માહિતી અને પ્રસારણ વિભાગના તા.૩૧/૦૭/૨૦૧૭ ના ઠરાવ ક્રમાંક:- જનલ/ ૧૦૨૦૧૭/
૨૪૩ /બ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ અન્વયે.
- (૩) નાણાં વિભાગના તા. ૨૨/૧૨/૨૦૧૬ ના ઠરાવ ક્રમાંક:- ખરચ/ ૧૦૨૦૧૬/૧૨૩૪/ઝ.૧
સચિવાલય, ગાંધીનગરના ઠરાવ અન્વયે.

પરિપત્ર :-

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ધ્વારા વર્ષ-૨૦૧૨-૧૩માં મુખ્યમંત્રી અમૃતમ યોજના રાજ્યનાં તમામ જીલ્લાઓના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો માટે અમલમાં મુકેલ. મુખ્યમંત્રી અમૃતમ "મા" યોજનાનો વ્યાપ વધારીને રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ "મા વાત્સલ્ય" યોજના રૂ. ૨.૫૦ લાખ કે તેથી ઓછી પારિવારીક વાર્ષિક આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારો માટે અમલ કરવામાં આવેલ. આ યોજના હેઠળ ગંભીર બિમારીઓ જેવી કે, હૃદય, કીડની, કેન્સર, નવજાત શિશુઓના ગંભીર રોગો, ગંભીર ઇજાઓ, બર્ન્સ અને મગજના રોગો માટે કુટુંબદીઠ વાર્ષિક મહત્તમ રૂ.૨,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા બે લાખ) સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. વર્ષ ૨૦૧૬થી યુ-વીન કાર્ડ ધારકોને પણ આ યોજના હેઠળ આવરી લીધેલ છે.

ઉક્ત દર્શાવેલ ઠરાવોથી નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ થી મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનામાં નવી ત્રણ કેટેગરીનો સમાવેશ કરવામાં આવેલ છે.

- ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના તમામ આશા બહેનો અને તેમના પરિવારજનો.
- પત્રકારો અને તેમના પરિવારજનો.
- રાજ્ય સરકારના વર્ગ- ૩ અને વર્ગ- ૪ ના તમામ સંવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂક આપેલ ફિક્સ પગારના કર્મચારીઓ.

યોજના હેઠળ લાભ મેળવવા માટે નવી ત્રણ કેટેગરીના લાભાર્થી કુટુંબે “મા વાત્સલ્ય” કાર્ડ કઢાવવું ફરજિયાત રહેશે. જે અંતર્ગત કાર્ડ કઢાવવા માટે નીચે મુજબની માર્ગદર્શક સુચનાઓને અનુસરવાનું રહેશે.

- ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના તમામ આશા બહેનો અને તેમના પરિવારજનો.
 - કાર્ડ કઢાવવા માટે આશા બહેનો અને તેમના પરિવારે રાશન કાર્ડ, ઓળખનો પુરાવો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર / શહેરી આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારીના હસ્તાક્ષર સાથેનું ફોટો સહિતનું પ્રમાણપત્ર બિડાણ (૧ અને ૨) મુજબ રજૂ કરવાનું રહે. ત્યારબાદ વેરિફાઇંગ ઓથોરિટી દ્વારા લાભાર્થી પરિવારનું વેરિફિકેશન કરી લાભાર્થીને સ્થાપિત કિઓસ્ક પરથી “મા વાત્સલ્ય”નું કાર્ડ આપવામાં આવે. જેમાં આવકની મર્યાદાની જરૂર રહેશે નહીં.
 - જો કોઈ આશા બહેનને કામગીરીમાંથી છુટા કરવામાં આવે તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર / શહેરી આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારીએ ત્વરિત સ્ટેટ નોડલ સેલ (મા યોજના) ને જાણ કરવાની રહેશે અને તેમનું “મા વાત્સલ્ય” કાર્ડ બ્લોક કરવામાં આવશે.

➤ પત્રકારો અને તેમના પરિવારજનો: -

- માહિતી ખાતા દ્વારા આપવામાં આવેલ નિયત યાદીમાં જે પત્રકારનું નામ સમાવિષ્ટ હોય તેમને જ “મા વાત્સલ્ય” યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
- કાર્ડ કઢાવવા માટે પત્રકારો અને તેમના પરિવારે રાશન કાર્ડ, ઓળખનો પુરાવો અને માહિતી વિભાગ દ્વારા આપેલ પત્રકાર તરીકેનું ઓળખપત્ર બિડાણ (૩) મુજબ રજૂ કરવાનું રહે. ત્યારબાદ વેરિફાઇંગ ઓથોરિટી દ્વારા લાભાર્થી પરિવારનું વેરિફિકેશન કરી લાભાર્થીને સ્થાપિત કિઓસ્ક પરથી “મા વાત્સલ્ય”નું કાર્ડ આપવામાં આવે. જેમાં આવકની મર્યાદાની જરૂર રહેશે નહીં.
- જો કોઈ પત્રકાર એકેડિટેશન રદ કરવામાં આવે તો તેની જાણ માહિતી વિભાગે તાત્કાલિક ફરજિયાતપણે સ્ટેટ નોડલ સેલ (મા યોજના) ને કરવાની રહેશે અને તેમનું “મા વાત્સલ્ય” કાર્ડ બ્લોક કરવામાં આવશે.

➤ રાજ્ય સરકારના વર્ગ- ૩ અને વર્ગ- ૪ ના તમામ સંવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂક આપેલ ફિક્સ પગારના કર્મચારીઓ: -

- કાર્ડ કઢાવવા માટે કર્મચારી અને તેમના પરિવારે રાશન કાર્ડ, ઓળખનો પુરાવો, નિમણૂક પામેલ ફિક્સ પગારના કર્મચારી તરીકેનો નિમણૂક પત્ર અને ફિક્સ પગારના કર્મચારી તરીકેનું સંબંધિત વિભાગ / કચેરીના વડાએ પ્રમાણિત કરેલ ફોટો સહિતનું પ્રમાણપત્ર બિડાણ (૪ અને ૫) મુજબ રજૂ કરવાનું રહે. ત્યારબાદ વેરિફાઇંગ ઓથોરિટી દ્વારા લાભાર્થી પરિવારનું વેરિફિકેશન કરી લાભાર્થીને સ્થાપિત કિઓસ્ક પરથી “મા વાત્સલ્ય”નું કાર્ડ આપવામાં આવે. જેમાં આવકની મર્યાદાની જરૂર રહેશે નહીં.